

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY
DIPLOMA ENGINEERING – SEMESTER – VI • EXAMINATION – SUMMER 2015

Subject Code: 3360611**Date: 11-05-2015****Subject Name: Solid Waste Management****Total Marks: 70****Time: 10:30am to 1:00pm****Instructions:**

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of only simple calculator is permitted in Mathematics.
6. English version is authentic.

Q.1 Answer any seven out of ten. દર્શમાંથી કોઈપણ સાતના જવાબ આપો. 14

1. Define Solid Waste Management.
2. Give importance of onsite handling of solid waste.
3. Enlist primary methods used in Landfill.
4. What is Domestic solid waste?
5. Give advantages of onsite incineration of solid waste.
6. Define hazardous solid waste.
7. What is Bio-medical waste?
8. List out different types of solid waste.
9. What is Commercial and Industrial Solid Waste?
10. What is 'Transformation' of solid waste?

Q.2 (a) Mention the purpose of solid waste separation. 03

પ્રશ્ન. 2 (અ) ધન કચરને અલગ કરવાના હેતુ ઉલ્લેખો. 03

OR

- (a) Explain planning of composting program. 03
- (અ) કોમ્પોસ્ટિંગ પ્રોગ્રામનું પણજીંગ સમજાવો. 03
- (b) Explain the objectives of onsite solid waste processing. 03
- (બ) સોલિડ વેસ્ટ પ્રોસેસિંગના સાઇટ ઉપર ના હેતુઓ સમજાવો. 03

OR

	(b) Define 'Recycling', 'Source reduction' and 'Reuse'.	03
	(બ) 'રિસાયકલિંગ', 'સોર્સ રીડક્શન' અને 'પુનઃઉપયોગ' વ્યાખ્યાયિત કરો.	03
	(c) Write a short note on Container size.	04
	(ક) કન્ટેઇનર માપ ઉપર ઢ્રેકનોંધ લખો.	08
	OR	
	(c) Explain following terms in details.	04
	i) Special wastes ii) Infectious wastes	
	(ક) નીચેના પદો વિગતવાર દ્રષ્ટિઓ સમજાવો.	08
	૧) ખાસ કચરો ૨) ચેપી કચરો	
	(d) Write a short note on 'Open dumping' of MSW.	04
	(સ) MSW ની 'ઓપન ડમપિંગ' ઉપર ઢ્રેકનોંધ લખો.	08
	OR	
	(d) Write a short note on 'Sanitary Landfill'	04
	(સ) 'સેનિટરી લેન્ડફિલ' ઉપર ઢ્રેકનોંધ લખો.	08
Q.3	(a) What are the factors that affect waste generation rate?	03
પ્રશ્ન. 3	(અ) વેસ્ટ જનરેશન રેટ ઉપર અસર કરતા પરિબળો કયા છે?	03
	OR	
	(a) Explain sources of Bio-medical waste.	03
	(અ) બાયો-મેડિકલ કચરાને ઉદભવ કરતા સોતો સમજાવો.	03
	(b) Write a short note on Plastic as a recovered material from MSW.	03
	(બ) MSW તરફથી વસ્તુલાત કરેલ સામગ્રી તરીકે પ્લાસ્ટિક ઉપર ઢ્રેકનોંધ લખો.	03
	OR	
	(b) Explain mechanical volume reduction.	03
	(બ) મિકેનિકલ વોલ્યુમ રિડક્શન સમજાવો.	03
	(c) Write a short note on 'Composting'.	04
	(ક) 'કંપોસ્ટિન્ગ' ઉપર ઢ્રેકનોંધ લખો.	08
	OR	
	(c) Write a short note on 'Heuristic routing'.	04
	(સ) 'હરિસ્ટિક રાઉટીંગ' પર ઢ્રેકનોંધ લખો.	08
	(d) Explain impact of solid waste on environment.	04
	(સ) પર્યાવરણ પર ધન કચરાની અસર સમજાવો.	08
	OR	
	(d) Write uses of old land fill of MSW.	04
	(સ) MSW ની જૂની લેન્ડફિલના ઉપયોગો લખો.	08
Q.4	(a) Give classification of hazardous solid waste.	03
પ્રશ્ન. 4	(અ) જોખમી ધન કચરાનું વર્ગીકરણ આપો.	03
	OR	
	(a) Explain toxicity of hazardous solid waste.	03
	(અ) જોખમી ધન કચરાની ટોક્સિસિટી સમજાવો.	03
	(b) Explain harmful effect of hazardous solid waste on community.	04

(બ્ય) જોખમી ધન કચરાની સમુદાય પર હાનિકારક અસરો સમજાવો.	08	
OR		
(બ્ય) Write a short note on transportation and disposal of Bio-medical waste.	04	
(બ્ય) બાયો-મેડિકલ કચરાના પરિવહન અને નિકાલ પર ટ્રેકનોંધ લખો.	08	
(ચ) Write a short note on:	07	
1. Shredding		
2. Screening		
(ઝ) ટ્રેકનોંધ લખો:	07	
૧) શ્રેડિંગ		
૨) સ્ક્રીનિંગ		
Q.5	(એ) Enlist methods of initiating source reduction.	04
પ્રશ્ન. ૫	(અ) સ્વોત ઘટાડો શરૂ કરવાની પદ્ધતિઓની યાદી બનાવો.	08
	(બ) Explain various methods used to quantify solid waste quantities.	04
	(ચ) ધન કચરાની માત્રા નક્કી કરવા ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ સમજાવો.	08
	(ચ) Explain recovery construction & demolition waste from MSW.	03
	(ઝ) MSW દ્વારા બાંધકામ અને ડિમોલિશન કચરાની પુનઃપ્રાપ્ત સમજાવો.	03
	(દ) Write short note on planning of solid waste collection program.	03
	(ઝ) ધન કચરાના સંગ્રહ કાર્યકર્મના આયોજન પર ટ્રેકનોંધ લખો.	03
